



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૪/૧૦/૨૦૧૪ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તેમજ જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૬૧/૧૪

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૯ કેસ કરી ૧૯ વ્યક્તિઓને ઝડપી, ૧૬૨ લીટર દેશી દારૂ, ૦૧ બોટલ ઇંગ્લીશ દારૂ, અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૦૭ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૯૪૦/- તથા જુગારનાં સાધનો કબજે કર્યાં હતાં.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૬૨/૧૪

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

નજર ચુકવી ચોરી :-

સમાચાર યાદી નં.૨૫૬૩/૧૪

સેટેલાઇટ : રમેશભાઈ મધુભાઈ પટેલ (રહે.સી/૨૦૨ અસાવરી ટાવર, વાઇડ એંગલ સીનેમા પાછળ, સેટેલાઇટ) એ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. તા.૧૪/૧૦/૧૪ બપોરનાં ૧/૪૫ વાગ્યાના સુમારે સેટેલાઇટ ઇસ્કોન સર્કલ પાસે, દેવાઈ મોલમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે જાહેર રોડ ઉપર રમેશભાઈ પોતાની કાર લઈને બેંકમાં પૈસાનો ડ્રાફ્ટ લેવા જતાં હતા ત્યારે એક મદ્રાસી જેવો મજબૂત બાંધાનો, રંગ શ્યામ એવો ઇસમ રમેશભાઈની ગાડીનો કાચ ખખડાવી “તમને બેંકમાં મેનેજર બોલાવે છે તેમ કહેતા રમેશભાઈ બેંકમાં જતાં ગાડીમાં બેસેલ ડ્રાઇવરને બીજા મદ્રાસી જેવા દેખાતા પુરૂષે ગાડીની બાજુમાં પૈસા નાંખી “તારા પૈસા પડી ગયેલ છે” તેમ કહી ડ્રાઇવર પૈસા લેવા જતાં ગાડીમાં પડેલ એક કાળા રંગની ઓફીસ બેગ જેમાં રોકડ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- હતા તે બેગ ડ્રાઇવરની નજર ચુકવી ચોરી કરી લઈ પલાયન થઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એમ.યુ.મશી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૫૬૪/૧૪

ઇસનપુર : રેખાબહેન ભીખાભાઈ ઠાકરે (ઉ.વ.૫૨)(રહે.સેક્ટર.૧૦/૧૨૧, ગુજરાત રીફાઇનરી બાજવા, વડોદરા) તા.૧૩/૧૦/૧૪ સવારના ૯/૧૫ થી ૯/૪૫ વાગ્યા દરમિયાન સી.ટી.એમ.થી નારોલ બસ સ્ટેન્ડ સુધીની બી.આર.ટી.એસ.બસની મુસાફરી દરમિયાન અજાણી વ્યક્તિએ રેખાબહેનનાં ગળામાં પહેરેલ સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ રેખાબહેન ઠાકરે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી દેવદત્તસિંહ કહળસિંહ ચલાવે છે.

ખાડીયા : શરદકુમાર લાલજીભાઈ ધોળકીયા (ઉ.વ.૫૮)(રહે.કૃષણા ટાવર, આનંદનગર રોડ, સેટેલાઈટ) એ તા.૧૩/૧૦/૧૪ ના રોજ ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૪/૧૦/૧૪ બપોરના ૧/૦૦ થી ૨/૦૦ વાગ્યા દરમ્યાન માણેક ચોક, માંડવીની પોળ આગળ આવેલ પોતાની મહાકાળી મેટલ્સ અને બાલાજી મેટલ્સ નામની દુકાનમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવેલ આરોપી (૧) ઉમેશભાઈ જશુભાઈ ચેખલીયા (૨) ગજરાબેન જશુભાઈ ચેખલીયા (૩) લીલાબેન કાંતીભાઈ ધુધરેજીયા (૪) નીતાબેન અશોકભાઈ વણક્યા (તમામ રહે.ગઢડા, જી.ભાવનગર) એ ભેગામળી શરદકુમારની નજર ચુકવી તાંબા, પિત્તળ અને સ્ટીલનાં વાસણો કુલ કિંમત રૂપિયા ૧,૬૭,૭૦૦/- ચોરી કરી લઈ ગયા છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આર.સંગાડા ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૨૫૬૫/૧૪

સાબરમતી : સુરેશરાવ ભવરલાલ રાવ (રહે.અનમોલ બંગલોઝ અયોધ્યાનગરી સોસાયટી પાછળ ન્યુ રાણીપ સાબરમતી) એ તા.૮/૧૦/૧૪ રાતના ૧૦/૦૦ વાગે રહેણાંક નજીક પોતાની મહીન્દ્રા કંપનીની ગાડી નંબર કેએ ૦૫ એમએલ ૮૯૩૫ કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૮/૧૦/૧૪ સવારના ૯/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ સુરેશરાવ રાવે તા.૧૩/૧૦/૧૪ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે એમ છાસીયા ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૫૬૬/૧૪

વટવા : પુજાબહેન લક્ષ્મણભાઈ ગંગોત્રી (ઉ.વ.૨૩)(રહે.રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલ) તા.૧૩/૧૦/૧૪ સવારનાં ૫/૧૦ વાગ્યાના સુમારે પુજા કરવા સારૂ અગરબત્તી સળગાવતાં હતા દરમ્યાન દિવાસળીની સળી કેરોસીનનાં ડબલા ઉપર પડતાં આગ લાગતાં પુજાબહેન દાઝી ગયા હતા. સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતે નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી “જે” ડીવીઝન ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૫૬૭/૧૪

શહેરકોટડા : અશ્વીનભાઈ ઇશ્વરભાઈ પરમાર (ઉ.વ.૨૮)(રહે.કુંજાલાલ પ્રભુદાસની ચાલી, ગવર્મેન્ટ ડી. કોલોની સામે નરોડા રોડ) એ કોઈ કારણસર તા.૧૩/૧૦/૧૪ સવારનાં ૧૧/૩૦ વાગ્યાનાં સુમારે છતની ઓંગલ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી જયપાલસિંહ વિજયસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.